



MEHTA HOUSING FINANCE LTD.

Plot No.13, Industrial Plot, Opp. T.V. Relay Centre, Mahuva, Bhavnagar - 364290

Email: mehtahousingfinanceltd@gmail.com

CIN: L15100GJ1993PLC020699

November 01, 2021

To,
General Manager,
The Department of Corporate Services-CRD,
BSE Limited,
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
Mumbai -400.001

Scrip Code: 511740

Subject: Newspaper Publication - Unaudited Standalone Financial Results for Quarter and Half year ended September 30, 2021

Dear Sir/Madam,

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed copies of the Unaudited Standalone Financial Results of Mehta Housing Finance Limited, for the quarter and half year ended September 30, 2021 published in "Free Press Gujarat" (English) and "Lokmitra" (Gujarati) newspapers on October 31, 2021.

The same have been enclosed herewith.

Kindly take the above on record and acknowledge.

Thanking You

Yours faithfully

For Mehta Housing Finance limited

Kinjal Kothari

Company Secretary & Compliance officer

Member Ship No: A60997

Encl: As Above

WR TO INTRODUCE NEW MEMU TRAIN SERVICES BETWEEN AHMEDABAD - VIRAMGAM

Ahmedabad, For the convenience of passengers travelling, Western Railway has decided to run new MEMU service between Ahmedabad & Viramgam. The new MEMU train will run as Train No. 09459/09460 Ahmedabad - Viramgam MEMU Special (Six days a week) Train No. 09459 Ahmedabad - Viramgam MEMU Special will depart from Ahmedabad at 18.30 hrs & will reach Viramgam at 20.10 hrs the same day. This train will run six days a week, except Saturday, with effect from 1st November, 2021. Similarly, Train No. 09460 Viramgam - Ahmedabad MEMU Special will depart from Viramgam at 07.50 hrs & will reach Ahmedabad at 09.55 hrs the same day. This train will run six days a week, except Sunday, with effect from 2nd November, 2021. Enroute this train will halt at Sabarmati, Chandlodia, Ambli Road, Sanand, Chharaod and Jakhavada stations in both directions. For detailed timings regarding the halts, passengers may please visit www.enquiry.indianrail.gov.in. Passengers are requested by Western Railway, to adhere to all norms, SOPs related to COVID-19 during boarding, travelling and at the destination.

18 Maharashtra boats caught for line fishing in Gujarat waters



Ahmedabad: Following a video of illegal fishing sent by Gujarat fishermen, coast guard and Somnath marine police conducted a joint patrolling on Wednesday evening and caught 18 boats with Maharashtra registration fishing illegally near Gujarat coast. Under an ordinance to the Gujarat Fisheries Act, cops seized these fishing boats and reported the matter to the fisheries department. According to the police, these boats were found conducting line fishing nine nautical miles away from Sutrapada coast on Wednesday. Line fishing is a method which is considered harmful and Gujarat's fishermen are opposing the use of this method. A local fisherman made a video and sent it to the authorities. According to fishermen, for the past few days nearly 200 Maharashtra boats were found conducting the illegal line fishing. All kinds of fish, including the juvenile are captured from a certain area in this kind of fishing, which results in drying up of catch for next few years from nearby areas. The ordinance, passed in the assembly with the intention of securing the rights of Gujarat's fishermen, also empowers police officials of sub-inspector rank of marine police station to search and seize boats found fishing near the Gujarat coast. It has also given adjudicating powers to sub divisional magistrate (SDM) to impose a fine of Rs 1 lakh to the boat owners and auction the catch. The SDM also has the authority to collect a five-time penalty of the amount of auction. "Maharashtra has since a long time implemented this law, but it has come into force in Gujarat since last year. Many Gujarat fishermen were made to pay heavy penalties comprising lakhs of rupees in Maharashtra while their boats also remained seized for two to three months.

New Delhi, Amid a spike in cases of dengue in Delhi, the Aam Aadmi Party (AAP)-led government has allowed hospitals in the national capital to divert one-third of the beds reserved for Covid-19 patients to those who are infected with dengue and other vector-borne diseases. "All the hospitals under the GNCT of Delhi may use one-third of the beds reserved for treating Covid patients, including ICU beds, for treating patients of vector-borne diseases like Dengue/Malaria/Chikungunya, if required," according to the government order on Saturday. The order pointed out that many of the beds reserved for Covid-19 cases are lying vacant due to the decline in the number of infections. According to news agency PTI, out of the 10,594

Delhi hospitals to divert one-third of beds reserved for Covid cases



hospital beds for Covid-19 patients in all hospitals, only 164 are occupied. Since the beginning of this year, Delhi has reported 1,000 cases of dengue. Of these, 280 were reported last week, according to the civic body's report this Monday. The first death was recorded on October 18. Before this, the Delhi government reduced the 750 Covid-19 beds at the Lok Nayak Jai Prakash (LNJP) Hospital to 450. Similarly, the beds at the Rajiv Gandhi Super Speciality Hospital were reduced from 600 to 350. Hindustan Times reported on October 25 that doctors reported more than a 60 per cent surge in the number of dengue cases over the past month and said that due to this increase, the number of beds is filling up rapidly.

Delhi govt on hookahs: 'Not important to drop guard for unnecessary service'

New Delhi, Opposing a bunch of pleas against the use of herbal hookahs in the capital, the state government on Friday told the Delhi high court that it is not necessary to lower the guard for an "unnecessary and ill-intended service which is likely to increase the severity and transmission of Covid-19". In a status report filed before Justice Rekha Palli, the Delhi government has said that due to the upcoming festivals, chances of a third wave of Covid, and discovery of a sub-variant of the virus in many states, it would like to continue the prohibition on the use of hookah (with and without tobacco) i.e. herbal hookah, water pipes and other hookah like devices in all public places including hotels, restaurants, eatery houses, bars, pubs and discotheques.

The city government has told the court that use and service of hookahs in restaurant and pubs is in contravention of State's Fire Prevention & Safety Act. The court directed the petitioners to file their response in the matter, and the case was adjourned to November 12. The city government has told the court that use and service of hookahs in restaurants and pubs is in contravention of State's Fire Prevention & Safety Act.

Prestige Group launches The Prestige City



Ahmedabad, India's leading real estate developer Prestige Group, announces the

launch of The Prestige City - "The City Within" at a strategically located Sarjapur Road in Bengaluru. Prestige City, an upcoming world class township project, promises to offer its residents an unmatched living experience fulfilling every dream and aspiration of families and all age groups. With luxurious homes and state-of-the-art infrastructure, The Prestige City is the perfect haven for homeowners to enjoy life to the fullest.

One of the fastest growing suburbs of Bengaluru, Sarjapur is a well-developed network of schools, health facilities, shopping arenas, the IT belt, job opportunities and hotels with an immense potential to grow into an exceptional example of community living. Prestige City, spread across 180 acres consists of a combination of housing plots, residential 2, 3, 4 BHK apartments, villas and townhouses. (19-10)

vivo Announces Exciting Festival Offers on V21 Series



Ahmedabad, Adding to the festive cheer, vivo, the innovative global smartphone brand has announced attractive Diwali offers on its V21 series smartphones. The V21 series smartphones feature a solid selfie camera setup and rear cameras that are adept at shooting night shots in utmost clarity. Now, with the onset of the festive season, buying these smartphones has become more rewarding, with the announcement of attractive pricing and offers. These attractive festive offers are applicable starting from November 1 and valid till November 7, 2021 across all mainline channels. During the offer period, consumers can avail an array of attractive offers* mentioned below - Pay INR 101 to get a vivo smartphone with Bajaj Finance, One-time screen replacement, 10 benefits worth INR 10,000, 10% Cashback on with Citibank, ICICI Bank, Kotak Mahindra Bank, IDFC First Bank & HDB Finance, One-year extended warranty with Zest FEMI. (20-4)

Science City organised Science Magic & Miracle Shows at its Amphitheatre



Ahmedabad, Gujarat Science City has organised a Science Magic Show in its Amphitheatre from 30th October 2021 to 3rd November 2021 from 6.30 pm to 8.30 pm. The program will display and demonstrate a series of science magic and miracles in an intention to develop a logical mind among the people and it shows that there is a concept of science in each miracle. Magic and science seem to be opposites - one is formed by facts, the other by illusions, one seeks to verify, the other to mystify. However, they are more alike than one might think. Science explains what magic makes us wonder. The show will be conducted by scientist Dr. R. M. Pandya and well known magician Shri Prateek Patel (S. Kumar). Since magic is deeply related with the latest technological and scientific discoveries, it is a good vehicle for getting more interest in science and technology from young students. We can take advantage of this and prepare a mystery for almost any lesson in the curriculum - expressed Dr. Harotram Sahoo, Executive Director, Science City. Join us as we explore the relationship between science and magic with renowned scientist and magician at Science City. -

vivo Festive Offer: Buy a Smartphone at INR 101 this Diwali



Ahmedabad, Adding to the joy of the festive season, vivo, the innovative global smartphone brand has announced attractive Diwali offers on popular smartphones - vivo X70 series, V21 series, V73 and V33; vivo flagship line-up X series have become synonymous with premium imaging technology. The recently launched vivo X70 series promises to offer professional-grade camera experience with built Ultra-Sensing Gimbal and unmatched performance with vivo's Professional Imaging Chip V1. Similarly, the V and V series smartphones have always been about disruptive design, excellent engineering, and innovation, making these smartphones the ultimate choice for consumers. Now, with the onset of the festive season, buying these smartphones has become more rewarding with the announcement of attractive pricing and offers. For the ones who are looking to grab on a great smartphone deal this festive season, it's their last chance to avail special offers on these magnificent smartphones with industry leading camera capabilities and other trendy features. (20-4)

MEHTA HOUSING FINANCE LTD. EXTRACT OF STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED SEPTEMBER 30, 2021

Sr No	Particulars	Quarter Ended		Half Year Ended	
		30.09.2021	30.06.2021	30.09.2021	30.09.2021
		(₹ in Lakhs)	(₹ in Lakhs)	(₹ in Lakhs)	(₹ in Lakhs)
1.	Total Income from Operations	0.00	0.00	0.00	0.00
2.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	(3.57)	(0.20)	(161.75)	(3.77)
3.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	(3.57)	(0.20)	(161.75)	(3.77)
4.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	(3.57)	(0.20)	(161.75)	(3.77)
5.	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	(3.57)	(0.20)	(161.75)	(3.77)
6.	Equity Share Capital	308.20	308.20	308.20	308.20
7.	Earnings Per Share of Rs. 10/- each (for continuing and discontinued operations) -				
1)	Basic	(0.116)	(0.006)	(5.248)	(0.122)
2)	Diluted	(0.116)	(0.006)	(5.248)	(0.122)

Notes:
1. Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year Rs.226.29 Lakhs as on March 31, 2021.
2. The above is an extract of the detailed Form of Un-audited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The said results along with the Limited Review Report of the Statutory Auditors are available on BSE Limited (BSE)'s website (<http://www.bseindia.com>) and the Company's website (<http://www.mehtahousing.com>). The Un-audited Financial Results were reviewed by the Audit Committee and by the Board of Directors at their Meeting held on October 30, 2021.

Date: 30.10.2021
Place: Mumbai
For Mehta Housing Finance Limited
Vishal Rapparel
Chairman & Managing Director
DIN: 00677762

PHYSICAL POSSESSION NOTICE

Branch Office: ICICI Bank Ltd. Office Number 201-B, 2nd Floor, Road No 1 Plot No-B3, WFI IT Park, Wagla Industrial Estate, Thane, Maharashtra-400064
Whereas The undersigned being the Authorized Officer of ICICI Bank Limited under the Securitisation, Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred on the borrower/s mentioned below, to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice. As the borrower failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules on the below-mentioned dates. The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of ICICI Bank Limited.

Sr. No.	Name of the Borrower/ Loan Account Number	Description of Property/ Date of Physical Possession	Date of Demand Notice/ Amount in Demand Notice (₹)	Name of Branch
1.	Savitri Mishra/ Shyam M Mishra/ LBSLR000049691313	Plot No. 61 Ground Floor And First Floor, Shivaji Park Row House Phase II, RS No 236, FP No 35/A/ Block No 363/A TP Scheme No 41 Moje Docol, Surat-394210/ October 28, 2021	March 25, 2021/ Rs. 33,86,591.00/-	Surat
2.	Nareesh S Panda/ Trinaban Panda/ LBRD00004985021	Flat No J-306, Tower 'J', 3rd Floor Divine Galaxy, RS No. 388, Block No.304, opp Lotus Court, NR Dps on Road Extension, Katali Village Road, Vadodara- 390014/ October 28, 2021	March 25, 2021/ Rs. 26,45,199.99/-	Vadodara

The above-mentioned borrower/s (s) guarantor/s (s) are hereby given a 30 day notice to repay the amount, else the mortgaged properties will be sold on the expiry of 30 days from the date of publication of this Notice, as per the provisions under the Rules 8 and 9 of Security Interest (Enforcement) Rules 2002.
Date : October 30, 2021
Place: Gujarat (Surat, Vadodara)
Authorized Officer
ICICI Bank Limited

Unjha Formulations Limited

REGD. OFFICE : KHALI CHAR RASTA, STATE HIGHWAY, SIDHPUR - 384 151

UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED ON 30TH SEPTEMBER, 2021

Sr	Particulars	QUARTER ENDED		QUARTER ENDED	
		30.09.2021	30.09.2021	30.09.2021	30.09.2021
		Unaudited	Unaudited	Unaudited	Audited
1	Total Income from Operations	234.10	207.35	1017.19	
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	(20.09)	16.59	10.35	
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	(20.09)	16.59	10.35	
4	Net Profit / (Loss) for the period (after Tax, after Exceptional and/or Extraordinary Items)	(20.09)	16.59	10.35	
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after Tax) and other Comprehensive Income (after Tax))	(20.09)	16.59	10.35	
6	Equity Share Capital	448.00	448.00	448.00	
7	Reserve (Excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of previous year	19.50	19.50	19.50	
8	Earnings Per Share (of Rs. 10/- Each) for continuing and discontinued operations				
1)	Basic	(0.45)	0.37	0.23	
2)	Diluted	(0.45)	0.37	0.23	

NOTES:
1. The above results was presented and adopted by Audit committee and Board of Directors meeting held on 30.10.2021.
2. Figure of previous year / period are regrouped wherever necessary.
3. There being only one segment of business, above represents figures of one segment.
4. As there are no extra ordinary items for the period the basic and diluted EPS before and after extraordinary items is identical.
5. The Company has no pending investor's complaints at the beginning and closing of the quarter.
By order of the Board
Date : 30.10.2021
CIN No. L99999G1994PLC029232
Ganpat Prajapati CFO
Mayank Patel (Managing Director)

MAITRI ENTERPRISES LIMITED

(CIN: L45208G1991PLC016853)
(Regd. Office: "Gayatri House", Ashok Vihar, Near Maitri Enterprise Society, Opp. Govt. Eng. College, Motera, Sabarmati, Ahmedabad 380005)
Phone No. 079-27506840/2751340 E-mail id: compliance@maitrienterprises.com, [website:www.maitrienterprises.com](http://www.maitrienterprises.com)

Part I Statement of Standalone un-audited Results for the Quarter and Half Year Ended on 30/09/2021 (Rs. In Lakhs Except EPS)

Particulars	Quarter ended		Half Year ended	
	3 months ended (30/09/2021)	Corresponding 3 months ended in the previous year (30/09/2020)	6 months ended (30/09/2021)	Corresponding 6 months ended in the previous year (30/09/2020)
	Unaudited	Unaudited	Unaudited	Unaudited
Total Income from operations	289.51	106.80	633.05	633.05
Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	12.73	2.63	16.43	16.43
Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	12.73	2.63	16.43	16.43
Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	11.46	1.58	14.23	14.23
Total comprehensive income for the period (comprising profit/loss for the period (after tax) and other comprehensive income (after tax))	11.46	1.58	14.23	14.23
Equity share capital	100.00	100.00	100.00	100.00
Earnings per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) Basic & Diluted	0.60	0.08	0.75	0.75

NOTES:
1. The financial results were reviewed by the Audit Committee and were thereafter approved by the Board of Directors of the Company at their respective meetings held on 20.10.2021. Statutory Auditors of the company have carried out the limited review in respect of the financial results for the quarter and half year ended on 30th September, 2021.
2. There are no separate reportable segments. The Company has only one reportable primary business segment.
3. The Company has adopted Indian Accounting Standards ("Ind AS") from April 01, 2017 and the above financial results are prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (IND AS) prescribed under Section 133 of Companies Act, 2013 and other recognised accounting practices and policies to the extent applicable.
4. The figures for the previous quarter/year have been regrouped/reclassified wherever necessary to make them comparable.

For Maitri Enterprises Limited
SD/-
Jaikishan Ambwani
Managing Director
(DIN:03592680)

Date: 30.10.2021
Place: Ahmedabad

